

૪(૧)(ખ)(૨)

હેરીટેજ સેલનાં અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

કેડરવાઈઝ કામગીરીનું પત્રક

અ. નં	કેડર	અધિકારી/ કર્મચારી ની સંખ્યા	કામગીરી
૧	કાર્યપાલક ઈજનેર હેરીટેજ સેલ	- ૦૧(સીવીલ):- પદ્ધીક ઈન્ઝાસ્ટ્રિકર સેલ, સ્વીમીંગ પુલ, ગાર્ડન પ્રોજેક્ટ સેલ, ડે.જનરલ મેનેજર, સીટીઝ-૧ (બાયો ડાયર્વસીટી પાર્ક) અને સેન્ટ્રલ ડિઝાઇન સેલની કામગીરી ઉપરાંત હેરીટેજ સેલની કામગીરી.	<ul style="list-style-type: none"> • સુરત શહેર વિસ્તારમાં હેરીટેજ સેલ હસ્તકના નવા પ્રોજેક્ટોના સમયસર કરાવવાની જવાબદારી તેમજ ખાતાના વડા તરીકે ખાતાની તમામ વહીવટી કામગીરી કરાવવાની જવાબદારી. • તાબા હેઠળના તમામ કર્મચારીઓને કામગીરીનું વિતરણ, સુપરવિઝન વિગેરેને લગતી કામગીરી. • આર.ટી.આઈ અંતર્ગત અપીલ અધિકારી તરીકેની કામગીરી.
૨	ડે. ઈજનેર (સીવીલ)	૦૧(સીવીલ):-(હેરીટેજ સેલની કામગીરી ઉપરાંત સેન્ટ્રલ ડિઝાઇન સેલની કામગીરી)	<ul style="list-style-type: none"> • સુરત શહેર વિસ્તારમાં હેરીટેજ સેલ હસ્તકના નવા પ્રોજેક્ટ વર્ક, પ્રોજેક્ટ વર્કના નિભાવ મરામતની સીવીલ વર્કની કામગીરી તેમજ ડે.ઈજનેરશ્રી નીચેની કક્ષાના કર્મચારીઓ પાસે ખાતાને લગતી તમામ પ્રકારની કામગીરી કરાવવાનું કામ. • આર.ટી.આઈ અંતર્ગત જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી.
૩	ડે. ઈજનેર (ઈલે.)	૦૧ (ઈલે.) -(૦૧):- ડ્રેનેજ વિભાગ ઉપરાંત હેરીટેજ સેલની વધારાની કામગીરી. (તા.૦૧/૦૪/૨૦૨૩ થી તા. ૧૬/૦૧/૨૦૨૪ સુધી). - (૦૧):- પદ્ધીક ઈન્ઝા.સેલ, સેન્ટ્રલ ડિઝાઇન સેલની કામગીરી ઉપરાંત હેરીટેજ સેલની કામગીરી. (તા. ૧૭/૦૧/૨૦૨૪ થી Continue.)	<ul style="list-style-type: none"> • સુરત શહેર વિસ્તારમાં હેરીટેજ સેલ હસ્તકના નવા પ્રોજેક્ટ વર્ક, પ્રોજેક્ટ વર્કના નિભાવ મરામતની ઈલે./મીકેનીકલ વર્કની કામગીરી તેમજ ડે.ઈજનેરશ્રી નીચેની કક્ષાના કર્મચારીઓ પાસે ખાતાને લગતી તમામ પ્રકારની કામગીરી કરાવવાનું કામ. • આર.ટી.આઈ અંતર્ગત જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી.
૪	આસી. ઈજનેર(સીવીલ),	- ૦૨(સીવીલ)	<ul style="list-style-type: none"> • હેરીટેજ સેલ હસ્તકના પ્રોજેક્ટોના અંદાજો નકશા તૈયાર કરાવવા તેમજ મંજુર થયેલ દરાવ મુજબ ટેન્ડરો બહાર પાડવાની તથા ટેન્ડરો મંજુર થયેથી કોન્ટ્રાક્ટ સોંપવાથી લઈ સ્થળ પર કામગીરી શરૂ કરવા તેની સ્થળ તપાસ કરી બાંધકામની સંપૂર્ણ દેખરેખ (સુપરવિઝન) તેમજ મરામત અને નિભાવાનું કામ, કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચુકવવા અંગેની કામગીરી તેમજ સમયમર્યાદામાં બાંધકામ પૂર્ણ કરાવી શરીનલ બીલ બનાવી ઈજારદારોને ચુકવણી કરવાથી ઓડીટ વાંઘાઓના નિકાલ સુધીની કામગીરી.

૫	આસી.ઈજનેર (ઈલે.)	<p>-૦૧) :- ડિપાર્ટમેન્ટ ઓફ એફોડિબલ હાઉસીંગ સેલની કામગીરી ઉપરાંત હેરીટેજ સેલની વધારાની કામગીરી (તા.૦૧/૦૪/૨૦૨૪થી તા.૧૬/૦૧/૨૦૨૪ સુધી.)</p> <p>(૦૧)- સાયન્સ સેન્ટરની કામગીરી ઉપરાંત કિલ્લાની વધારાની કામગીરી.</p> <p>-૦૧) :- પદ્ધ્લીક પાર્ક એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટની કામગીરી ઉપરાંત હેરીટેજ સેલની વધારાની કામગીરી (તા.૧૭/૦૧/૨૦૨૪ થી Continue.)</p>	<ul style="list-style-type: none"> હેરીટેજ સેલ હસ્તકના પ્રોજેક્ટોના અંદાજો નકશા તૈયાર કરાવવા તેમજ મંજૂર થયેલ છરાવ મુજબ ટેન્ડરો બહાર પાડવાની તથા ટેન્ડરો મંજૂર થયેથી કોન્ટ્રાક્ટ સોંપવાથી બદ્ધ સ્થળ પર કામગીરી શરૂ કરવા તેની સ્થળ તપાસ કરી ઈલે./મીકેનીકલ નું કામ ઈન્સ્ટોલેશન કામનું સંપૂર્ણ દેખરેખ (સુપરવિઝન) તેમજ મરામત અને નિભાવાનું કામ, કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચુકવવા અંગેની કામગીરી તેમજ સમયમર્યાદામાં ઈલે./મીકેનીકલ કામ પૂર્ણ કરાવી ફાઈનલ બીલ બનાવી ઈજારાદારોને ચુકવણી કરવાથી ઓડીટ વાંધાઓના નિકાલ સુધીની કામગીરી.
૬	સુપરવાઈઝર	<p><u>-૦૧(સીવીલ)</u></p> <p><u>-૦૨:- (સીવીલ) (તા.૦૧/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૧/૨૦૨૪)-પ્રમોશન.</u></p> <p>ઈલે.સુપરવાઈઝર : ૦૧:- (સાઉથ વેસ્ટ ઝેન્ની કામગીરી ઉપરાંત હેરીટેજ સેલમાં શહીદ સ્મારકની વધારાની કામગીરી)</p>	<p>સ્થળ પર ચાલતા પ્રોજક્ટોની દેખરેખ રાખવાની, માલ-સામાન રજીસ્ટરો જેવા કે સીમેન્ટ તથા સ્ટીલ ઈન્કમ્બીંગ તથા વપરાશ રજીસ્ટર, કયુબ રજીસ્ટર, કેલીબ્રેશન રજીસ્ટર, સાઈટ વિઝીટ રજીસ્ટર, સીમેન્ટ / સ્ટીલ ટેસ્ટીંગ રજીસ્ટર વિગેરે તમામ રજીસ્ટરો મેઇન્ટેઇન કરવાની તથા આસી.ઈજનેર / જુની.ઈજનેરની સુચના મુજબ કામ કરવાની જવાબદારી, ટેક.આસી.ની કામગીરીનું સુપરવિઝન કરવાની કામગીરી અને જે તે પ્રકલ્પનું કવોલીટી કન્ટ્રોલ બાબતે સુપરવિઝન રાખવા બાબતની કામગીરી.</p> <p>-ઈલે.સુપરવાઈઝર : ૦૧:- (સીવીલ)</p> <p>ટેસ્ટીંગ/કમિશનિંગ/ મરામતની કામગીરીનું સુપરવિઝન ઉપરી અધિકારીની સુચના મુજબ કરવું.</p> <p>- મશીનરીઓનું બ્રેકડાઉન એટેન્ડ કરી દુરસ્ત કરવાની/ કરાવવાની કામગીરી.</p> <p>- ઈલેક્ટ્રોકલ અને મીકેનીકલ મશીનરીઓની લોગબુકનું ચેકીંગ કરવું.</p> <p>- તાબા હેઠળના વાયરમેન, હેલ્પર કક્ષાના કર્મચારી પાસે આનુસંધિક કામગીરી લેવી.</p> <p>- જુદી જુદી કામગીરી અંતર્ગત ઉપરી અધિકારીને રીપોર્ટ કરવો તેમજ તેમની સુચના મુજબ કામગીરી કરવી.</p>
૭	ટેક. આસી.	<u>૦૩(સીવીલ)</u>	<ul style="list-style-type: none"> હેરીટેજ સેલ હસ્તકના સ્થળ પર ચાલતા પ્રોજેક્ટો પર દેખરેખ રાખવાની માલ-સામાન રજીસ્ટરો જેવા કે સીમેન્ટ તથા સ્ટીલ ઈન્કમ્બીંગ તથા વપરાશ રજીસ્ટર, કયુબ રજીસ્ટર, કેલીબ્રેશન રજીસ્ટર, સાઈટ વિઝીટ રજીસ્ટર, સીમેન્ટ / સ્ટીલ ટેસ્ટીંગ રજીસ્ટર વિગેરે તમામ રજીસ્ટરો મેઇન્ટેઇન કરવાની જવાબદારી, આસી.ઈજનેર / જુની.ઈજનેરની સુચના મુજબ કામ કરવાની જવાબદારી.

૮	ડે. એકાઉટન્ટ	-(૦૧) :- હેરીટેજ સેલ, લાઈટ એન્ડ એન્જી.એફીસીયેન્સી સેલ, સુમન સેલ, ટ્રાફિક સેલની કામગીરી.	<ul style="list-style-type: none"> ખાતાના રેવન્યુ, કેપીટલ તથા પર્સનલ એડવાન્સ બીલો ચેક કરવાની કામગીરી. કેપીટલ તથા રેવન્યુ બજેટ તૈયાર કરવાની કામગીરી. હેરીટેજ સેલના બીલો અંગે હિસાબી ખાતા સાથે સંકલન, ઓડિટ ઓઝ્ઝેક્શન, જર્નરલ એડવાન્સ અંગેની આંકડાકીય માહિતીઓનું પૃથ્વકરણ.
૭	સેક્શન ઓફિસર	(૦૧) :- (તા. ૩૧/૦૭/૨૦૨૩ થી તા. ૩૦/૦૮/૨૦૨૩) :- (૦૧/૦૯/૨૦૨૩ થી તા. ૩૧/૧૨/૨૦૨૩) – રીટાઇએડ :- (ઈ.ચા.સેક્શન ઓફિસર તા. ૨૮/૦૨/૨૦૨૪ થી Continue.)	<ul style="list-style-type: none"> ઓફિસની રોજબરોજની કામગીરી ઉપર દેખરેખ, તમામ ખાતાના સંકલનમાં કરવામાં આવેલ પત્રવ્યવહારનો રેકૉર્ડ રાખવો, RTI એકટ અંગેની કામગીરી, કલેરીકલ સ્ટાફ પાસે સમયબધ્ય રીતે કામગીરી કરાવવી અને માર્ગદર્શન આપવું તથા તાકીદની કામગીરીને અગત્યતા આપી નિકાલ કરાવવા અંગેની કામગીરી.
૮	ગ્રીજી શ્રેષ્ઠી કલાર્ક	૦૧	•ઈનવર્ડ/આઉટવર્ડ ની કામગીરી તેમજ બીલ બનાવવાની કામગીરી.
૯	પટાવાળા	૦૧-(કાયમી) ૦૧ – (તાલીમાર્થી તા. ૩૦/૧૨/૨૦૨૨ થી ૩૪૨)	•ખાતાની ટપાલ વહેચવાની તેમજ સાફ્સફાઈ તથા સ્ટાફના હુકમ અનુસાર કરવાપાત્ર કામગીરી વગેરે.